

K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE : DESHNA CHAMBERS, B/H. KADVA PATIDAR VADI, USMANPURA,
ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE : 079-27543200
CIN L 65910 GJ 1986 PLC 008864

11th November, 2017.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: **511728**

Dear Sir,

Sub.: Newspaper Advertisement of Financial Results for the Quarter and Half year ended 30th September, 2017.

Ref.: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Financial results for the quarter and half year ended 30.09.17, as published in the Newspaper in English as well as Gujarati language.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED


Pravinkumar Patel
Managing Director
(Din: 00841628)



Encl: as above

Ashok Leyland, Hosur Unit II conferred the 2017 Deming Prize for Quality Management



Chennai: Ashok Leyland, a flagship of the Hinduja Group, yesterday received the prestigious 2017 Deming Prize for its Hosur Unit II manufacturing facility. The Deming Prize is one of the highest awards on Total Quality Management. It is a global award which is the oldest and most widely recognized award in the world, given to companies that have established customer oriented business objectives and strategies, and implemented Total Quality Management (TQM) to achieve them. In 2016, Ashok Leyland Pantnagar plant had become the first truck and bus plant in the world and also the only CV manufacturer outside of Japan to win this coveted award. With the Hosur Unit II plant winning this year, Ashok Leyland becomes the

only CV manufacturer outside of Japan to achieve this feat consecutively. Mr. Vinod K. Dasari, Managing Director, Ashok Leyland, said, "Ashok Leyland brand stands for quality. Our endeavor is to achieve the best quality in everything that we do. Winning the Deming Prize consecutively for our second unit is a testimony to our efforts and our belief. All of us at Ashok Leyland are very proud to have achieved this. Delivering quality has been an integral part of our brand promise of 'Aapki Jeet, Hamari Jeet' and we will continue to raise the bar for ourselves and the industry. This is indeed a big milestone in our journey and adds another feather to company's achievements of delivering industry firsts."

Swanesan, Senior Vice President - Quality Sourcing and Supply Chain, Ashok Leyland, said, "Following Pantnagar, our Hosur plant has now secured the highest recognition in TQM which no other CV manufacturer, outside Japan, has achieved. Sharing his views, Mr. Harinar P, Senior Vice President - Manufacturing and Project Planning, Ashok Leyland, "Winning the Deming Prize for our two manufacturing facilities is indeed a proud achievement for us. The Deming Prize was established in 1951 by Japanese Union of Scientists and Engineers (JUSE) to honor W. Edwards Deming, who contributed greatly to Japan's proliferation of statistical quality control after World War II.

New Startup competition launched

Ahmedabad, Claris Capital has launched a new startup competition called "JNC - Idea to Incorporation" to support and encourage Gujarat based entrepreneurs to generate innovative startup ideas. The competition will offer aspiring startups a platform to meet investors and various industry leaders. The final round of the competition will take place in February 2018 where shortlisted applicants will get a chance to present their ideas to an acclaimed set of jury. The winners of the competition will not only receive prize money from Claris Capital, but will also be mentored by renowned experts for commercialization of their startup ideas.

To participate in the event, the applicant must either be a student from University or incubation centre registered in Gujarat. Start-ups registered under academic/government incubation centers from Gujarat can also apply for this competition. In addition, recently pass-out student (0-3 years) from registered college or university of Gujarat can also apply in the competition. Applicants will be selected based on their out-of-the-box ideas, integrity, ability to execute and various other financial and strategic parameters. Speaking about this competition, Ms. Krishna Handa of Claris Capital said, "JNC is an attempt to motivate aspiring young entrepreneurs of Gujarat to get started in entrepreneurship at an early stage. Our aim is to motivate and mentor innovators to work towards turning their concepts into a business in order to ensure participation from every corner of Gujarat, to major universities and college campuses in all key centers such as Ahmedabad, Rajkot, Surat, Jamnagar and so on. With this competition we want to break the myth that startup ideas are mostly urban. We are looking for entrepreneurs with the ability to execute an idea and something very realistic that can make an impact on society. We hope to make it a very inclusive platform where each innovative idea to get a chance to be heard."

Business Brief

M&A deals declined 22% in October, says report

Mumbai, The merger and acquisition (M&A) deals in the country declined 22 per cent in October on a year-on-year (YoY) basis, a report said on Thursday. According to Grant Thornton's M&A dealtracker report for October 2017, the industry's M&A deals declined to 35 from 45 reported for the corresponding month of last year.

The report pointed out that a total of \$3.7 billion worth of M&A transactions were spread across 35 deals during the month under review, whereas in October 2016, the country's M&A activity recorded 45 deals worth \$17.2 billion. Both domestic M&A and cross-border have been on a decline this month and the reason seems to be that industry is busy dealing with the implementation issues around GST, said Prashant Mehra, Partner at Grant Thornton India LLP.

World food import bill to hit \$1.4 tn, warns UN

Rome, Despite generally stable food commodity prices, the cost of food imports will reach \$1.413 trillion this year - a six percent rise from the previous year and the second highest figure on record, the United Nations said on Thursday.

Pricier food imports will impact the world's least developed and poorest countries the most, causing double-digit increases in their food import bills, said the UN Food and Agriculture Organisation's newly published Food Outlook report.

Increased international demand for most foodstuffs are driving up import bills, as well as higher freight rates, according to the report. Higher prices do not necessarily translate into more food being bought by them as the cost of importing has greatly escalated, said FAO economist Adam Pakash. The higher import costs come at a time when inventories are robust, harvest forecasts are strong and food commodity markets remain well supplied, said FAO whose headquarters are in Rome. The food commodity outlook, issued twice a year, takes a close look at the markets of key food categories, including cassava, the livestock and dairy sectors, fish, vegetable oils and the main cereal grains.

Plastindia 2018 will display Gujarat's dominance in Plastics industry

Ahmedabad, The 12th National Plastic Investment outlet of \$43 billion, \$252 billion and \$220 billion in water management, irrigation and power generation respectively spell boom times for the Plastics industry of Gujarat in the next few years. The industry has a planned investment of over \$12 billion in plastics machinery to cater to anticipated annual growth rate of above 10% in next five years.

Briefing the media K K Sekaria, President, Plastindia Foundation said that "Gujarat has always been the hub of plastics production in India. Gujarat produces over 60% of plastic raw material (polymers) and also 60% of technology & machines for plastic production. Gujarat's contribution to India's plastics industry is more than Rs. 90,000 crore that includes processing, machinery and raw material and is surging at growth rate of 15% per annum. The macro-economic factors such as thrust on import-substitution that is making in India, digital India, Digital India, Clean India, Smart Cities, rural electrification, irrigation projects, rising per capita income, burgeoning middle class etc. would form the backdrop for some exciting times ahead for Gujarat's plastics industry. He further added that the Plastindia '18 is going to be a great opportunity for Plastics industry of Gujarat to take their industry to next level. He also spoke regarding Plastindia Foundation's initiative to set up Plastindia International University at Vapi Gujarat with support of Gujarat Govt and Plastindia's sincere efforts to develop plastics products for common man's use reduced from 28% to 18% or 12%."

SpiceJet launches country's first ever Airline Gift Card

Gurugram, SpiceJet, country's favourite airline today launched India's first ever gift card in the domestic airline category. With some very unique features, SpiceJet Gift Card is meant to be gifted to loved ones. It allows customers to travel to destinations of their choice at a time convenient to them. The cards are valid for air fare as well as add-ons on SpiceJet.

Be it a birthday or an anniversary or any other occasion, SpiceJet Gift cards allows customers a plethora of options to choose from besides 'personalization' being the best feature. Offering a wide range of gifting options from Rs. 500 to Rs. 50,000, customers can now get their gifts tailor-made to suit their pocket. The launch of gift card services is expected to boost the airline's ancillary revenue significantly.

Commenting on SpiceJet Gift Cards, Ms. Shilpa Bhatia, Chief Sales and Revenue Officer, SpiceJet said, "We have always believed in introducing innovative products and services for the benefit of our passengers. SpiceJet has just launched an exciting product that will allow your loved ones to associate great memories with their air travel. We intend to add more features and functionality in the months to come, to make it a great product and platform for our customers."

Equity indices trade lower on global cues, selling pressure

Mumbai, Key Indian equity indices traded lower during Friday's mid-afternoon session on the back of negative global cues, coupled with a weak rupee and heavy selling pressure in automobile, metal and oil and gas stocks.

Index heavyweight like Tata Motors, Sun Pharma, Adani Ports and Asian Paints, among others, traded in the red. According to market observers, investors traded on a cautious note ahead of the GST Council's decision on tax rates.

Around 12.45 p.m., the wider Nifty50 of the National Stock Exchange (NSE) traded lower by 16.80 points, or 0.16 per cent, at 10,292.15 points. The BSE market breadth was slightly improved at 33,235.75 points, traded at 32,206.09 points - down 44.84 points, or 0.13 per cent - from Thursday's close. The Sensex has so far touched a high of 33,280.55 points and a low of 33,130.94 points during intra-day trade. The BSE market breadth was slightly bearish - 1,286 declines and 1,215 advances. "The Indian rupee traded lower and headed for its biggest weekly drop in seven weeks. The shares of Larsen and Toubro, ONGC and State Bank of India rose, whereas shares of Tata Steel, Reliance and Asian Paints fell," Dhruv Desai, Director and Chief Operating Officer of Tradebliss, told IANS. "The GST Council may consider reducing items in the 28 per cent tax slab and slash rates for daily use items, plastic products and hand-made furniture as it looks to provide relief to consumers," said Desai.

Flipkart Launches 'Made For India' Billion Capture+ Smartphone

New Delhi, Flipkart, India's largest e-commerce platform, today launched its first 'Made For India' smartphone - Billion Capture+ - targeted at the average consumer to address the unique needs of Indian customers. The Billion Capture+ is designed, engineered, manufactured and tested in India. It is part of Flipkart's private label Billion, and will go on

sale exclusively on Flipkart from Nov. 15. The rich specifications of the Billion Capture+, arrived at after analyses of millions of customer reviews on Flipkart, fill some critical gaps between customer aspirations and what is currently on offer in the market. The Billion Capture+ packs top-end features usually reserved for flagship smartphones, such as 13MP + 5MP dual camera setup, a long-lasting battery with Quick Charge™, powerful Snapdragon™ 625 octa-core processor for breezy multitasking, free unlimited storage and the latest Android Nougat. The phone has a premium metal body with easy-to-hold curves and a fingerprint sensor on the back for ease of use.

"The Billion brand's products have always been backed by meticulous data-driven research and insight into Indian customers' needs. The features in the Capture+ too have been derived from deep data-mining of millions of Flipkart customers' reviews. We're sure this customer-centricity will delight Indian smartphone buyers," said Sachin Bansal, Co-Founder and Executive Chairman, Flipkart.

Shrikish Thite, Category Head, Billion, added, "Our extensive research of Indian smartphone buyers revealed major pain points of battery, camera, storage etc. We developed the Billion Capture+ keeping these in mind and are delivering it at a compelling price point. It is a truly made for India phone." The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

KoPT expects to achieve 8% growth in traffic handling

Kolkata, The Kolkata Port Trust (KoPT) expects to achieve around 8 per cent growth in traffic handling to 55 million tonnes by the end of the current fiscal, an official said on Friday.

Up to October 31 (in the current fiscal), we have handled 32 mt of traffic both in Haldia Dock and Kolkata dock system as against 28 mt in the corresponding period last year," KoPT Chairman Vinit Kumar said.

"The port is expected to handle 55 mt of traffic by the end of this fiscal (2017-18 or FY18) as compared to around 51 mt of traffic handled last year," he said on the sidelines of an event for a new building of the Chamber of Commerce and Industry.

The port had handled 27.565 mt of traffic in April to September, against 24.623 mt in the same period last year, recording a growth of 12 per cent, much more than the average growth rate of 3.24 per cent clocked by major Indian ports. He also said the port was working with the Indian Institute of Technology (IIT) Madras for a new scheme of dumping of the dredged material.

"When it accumulates silt, the dredger has to go around 13 nautical miles away to drop the silt and re-dred it. In this process, almost three hours are wasted. We are planning to dump the silt on the Nayachar Island (in Hooghly river). We have requested the state (West Bengal) government for permission and we are finalising this scheme with IIT Madras, wherein there will be a pipeline kind of structure, where vessels can dump the silt, from where it will go to the island," he added.

Domestic net interest margin rose 9 basis points over the previous quarter to 2.59 per cent. The lender's non-interest income at Rs 16,016 crore was a 58 per cent increase over the same quarter last year at Rs 10,146 crore and double over the previous quarter's Rs 8,006 crore.

Fresh slippages in the second quarter at Rs 9,026 crore recorded a sharp 65 per cent fall over the previous quarter's figure of Rs 26,249 crore. Slippages from watchlist amounted to Rs 10,424 crore, while the total watchlist stood at Rs 21,288 crore.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI Q2 net at Rs 1,581 cr down 37% as asset quality improves

Mumbai, State-run SBI Bank of India on Friday posted a 37 per cent fall in standalone net profit for the second quarter ending September at Rs 1,581 crore pulled down by higher provisioning for the period.

The country's biggest lender had registered a profit after tax of Rs 2,006 crore in the corresponding period of the last fiscal, the bank said in a stock exchange filing here.

SBI's total provisioning, including for non-performing assets (NPAs), or bad loans, for the quarter in consideration at Rs 18,418 crore were a whopping 87 per cent over the previous quarter's figure of Rs 9,869 crore and also 27 per cent higher during the provisioning in the same period last year.

Of the total provisioning, that on account of loan losses was Rs 6,715 crore in the corresponding period, however, improved during the July-September quarter as fresh slippages declined by more than half. Slippages from watchlist amounted to Rs 10,424 crore, while the total watchlist stood at Rs 21,288 crore.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

SBI's net bad loan ratio decreased relative to the previous quarter to 5.43 per cent from 5.97 per cent.

Flipkart's 'Billion Capture+' smartphone comes with dual camera

Bengaluru, The "Billion Capture+" smartphone from the e-commerce site Flipkart that will go on sale from November 15 comes in two variants with dual primary camera.

The Rs 10,999 device will have 3GB RAM and 32GB internal storage while the Rs 12,999 handset will have 4GB RAM and 64GB ROM.

Designed and manufactured in India, the smartphone is part of Flipkart's private label "Billion" which was announced in July.

In terms of specifications, the device sports 13MP + 5MP dual cameras with dual-tone flash and runs an octa-core Qualcomm Snapdragon 625 processor that also powers Xiaomi's hugely popular Redmi Note 4.

"Our research of Indian smartphone buyers revealed major pain points of battery, camera, storage etc. We developed the Billion Capture+ keeping these in mind," said Shrikish Thite, Category Head, Billion, in a statement.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

The Billion Capture+ comes with a flagship 13MP + 5MP dual rear camera setup. Its powerful rear camera are twinned with RGB and monochrome sensors that work like the human eye to capture vibrant colors in vivid detail.

Riversong launches two new fitness trackers

New Delhi, China-based Smart gadget brand Riversong on Friday launched two series of fitness trackers - "Wave FIT" priced at Rs 299 and Rs 2,199 respectively.

While "Wave BP" comes with enhanced sensors to help monitor blood pressure, "Wave FIT" empowers the users through an all-day activity tracker.

"We are thrilled to launch our premium Fitness trackers - Wave BP and Wave FIT - in the Indian market," Navin Kumar, CEO (India), Riversong, said in a statement.

"We are committed in providing an extension to the fitness goals while keeping the outlook for having fun intact," added Liu Chunming, Founder, Riversong.

Both the products are connected via an app that can be downloaded from Google Playstore - H Band 2.0 for "Wave BP" and RS Band for "Wave FIT."

Both the products are connected via an app that can be downloaded from Google Playstore - H Band 2.0 for "Wave BP" and RS Band for "Wave FIT."

Both the products are connected via an app that can be downloaded from Google Playstore - H Band 2.0 for "Wave BP" and RS Band for "Wave FIT."

Both the products are connected via an app that can be downloaded from Google Playstore - H Band 2.0 for "Wave BP" and RS Band for "Wave FIT."

K.Z. LEASING AND FINANCE LIMITED

CIN : L6510G1986P000864
 Regd. Office : 1st Floor, Desha Chambers, Behind Kadua Padidar (Wadi), Usmangura, Ashram Road, Ahmedabad - 380014.
 Phone : (079) 27543200

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30/09/2017. (Rs. in Lakhs)

S. No.	Particulars	Quarter ended		Half Year		Previous Year
		30/09/17	30/09/16	30/09/17	30/09/16	
1	Total Income from Operations (net)	14,001	14,600	3,400	3,800	89,398
2	Net Profit / (Loss) from ordinary activities before tax	2,204	5,900	4,600	11,732	17,332
3	Net Profit / (Loss) for the period after tax	2,94	5,900	4,68	8,78	16,312
4	Paid up Equity Share Capital (Share of Rs 10/- each)	304.12	304.12	304.12	304.12	304.12
5	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	--	--	--	--	--
6	Earnings per share (EPS) - Basic	00.10	00.19	00.15	00.29	00.29
7	- Diluted	00.10	00.19	00.15	00.29	00.29

Notes: (1) The above results were reviewed by the Audit Committee on 10/11/2017 and taken on record by the Board of Directors of the Company at its meeting on 10/11/2017. The above results have been reviewed by the Statutory Auditors of the Company. (2) The above is an extract of the detailed format of Quarterly and Half yearly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI Listing Obligations and Disclosure Requirements, Regulation 015. The full format of financial results is available on the Company's website www.kzgroupindia.com and Bombay Stock Exchange website www.bseindia.com. Place: Ahmedabad For: K. Z. Leasing & Finance Ltd. Date: 10/11/2017. s/d/- Pravin Kumar K. Patel (DIN- 00841628)

PUBLIC NOTICE

Notice is hereby given that the membership of the following member(s) of the National Commodity and Derivatives Exchange Ltd. (NCDEX) have been terminated in accordance with the provisions of Rule 8.9 of the Exchange Rules upon their failure to comply with eligibility requirement as specified under Rule 8 of Securities Contract (Regulation) Rules, 1957 (SCRR).

Sl. No.	TMD	Name of Member	Member's Correspondence Address
1	934	Sureshkumar R Thakkar	16, Madhav Road, Baveliya-383030.

The registered constituents of the above aforesaid members who have undertaken any trades through these members, are hereby advised to lodge their claims, if any against the said member(s) within 60 (sixty) days from the date of this notification. After the date, if shall be presumed that there is no claim against the aforesaid members. Non filing of the claim within the stipulated period of 60 days shall be deemed to be a waiver of any claims against the aforesaid members. The arbitration and adjudication of the claim shall be at the sole discretion of the Exchange and upon the Regulatory Directives, if any.

The constituents may write to Ms. Shilpa Desai, Vice President, Arbitration & Investor Services Department, National Commodity and Derivatives Exchange Ltd., Auktari Complex, 1st Floor, LBS Marg, Karyunjyari (W), Mumbai - 400 078 or email at ipo@ncdex.com.

Place: Mumbai Date: 13/11/2017 For National Commodity and Derivatives Exchange Ltd. Sd/- Membership